

# Ziyarat E Waritha

ઝિયારતે વારેસા

زِيَارَت وَاَرِثَا

For any errors/comments please write to [alirazae@hotmail.com](mailto:alirazae@hotmail.com)

Kindly recite Sura E Fatiha for Marhumeen of all those who have worked towards making this small work possible.

To display the font correctly, please use the Arabic font "Attari\_Quran\_Shipped" & Gujarati "LMG-ARUN"

Download font here : <http://www.duas.org/fonts>

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

અય અલ્લાહ ! મોહંમદ (સ.અ.વ.) અને આલે મોહમદ (સ.અ.વ.)  
ઉપર સલવાત નાઝિલ કર.

**O Alláh send Your blessings on Muhammad  
and the family of Muhammad.**



بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

**In the name of Alláh the Beneficent, the Merciful.**



السَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ آدَمَ صَفْوَةَ اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહ તરફથી ચૂંટેલા આદમના  
વારીસ

**Peace be on you, O' inheritor (of the qualities) of Adam (first prophet) (a.s), the one purified by Alláh!**



السَّلَامُ عَلَیْكَ يَا وَارِثَ نُوحِ نَبِيِّ اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહના નબી નૂહ (અ.સ.) ના  
વારીસ

**Peace be on you, O' inheritor (of the  
qualities) of Nooh (a.s) the prophet of Alláh!**



السَّلَامُ عَلَیْكَ يَا وَارِثَ اِبْرَاهِیْمَ خَلِیْلِ  
اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહ ના દોસ્ત ઈબ્રાહીમ  
(અ.સ.)ના વારીસ

**Peace be on you, O' inheritor (of the  
qualities) of Ibraaheem (a.s), the one devoted  
in love of Alláh !**



السَّلَامُ عَلَیْكَ يَا وَارِثَ مُوسَى كَلِيمِ  
اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહ સાથે વાત કરનાર મુસા  
(અ.સ.) ના વારીસ

**Peace be on you, O' inheritor (of the qualities) of Moosa (a.s), who received direct communication from Alláh!**



السَّلَامُ عَلَیْكَ يَا وَارِثَ عِيسَى رُوحِ  
اللَّهِ

સલામ થાય આપ પર અય રૂહે ખુદા ઈસા (અ.સ.)ના વારીસ

**Peace be on you, O' inheritor (of the qualities) of E'esa, the Holy Spirit of Alláh!**



السَّلَامُ عَلَیْكَ يَا وَارِثَ مُحَمَّدٍ حَبِيبِ  
اللَّهِ

સલામ થાય આપ પર અય હબીબે ખુદા મોહંમદ (સ.અ.વ.)  
ના વારીસ

**Peace be on you, O' inheritor (of the qualities) of Muhammad (s), the one most beloved of Alláh!**



السَّلَامُ عَلَيْكَ يَا وَارِثَ عَلِيِّ أَمِيرِ  
 الْمُؤْمِنِينَ عَلَيْهِ السَّلَامُ وَلِيِّ اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહના વલી અમીરુલ  
 મોઅમેનીન અલી (અ.સ.) ના વારીસ

**Peace be on you, O' inheritor (of the  
 qualities) of Ali (a), the commander of the  
 faithfuls, and the vicegerent of Alláh!**



السَّلَامُ عَلَیْكَ يَا بِنَ مُحَمَّدٍ  
الْمُصْطَفَى

સલામ થાય આપ પર અય મોહંમદ મુસ્તફા (સ.અ.વ.)ના  
ફરજંદ

**Peace be upon you, O' son of Muhammad (s),  
Messenger of Alláh !**



السَّلَامُ عَلَیْكَ يَا بَنَ عَلِي الْمُرْتَضَى

સલામ થાય આપ પર અય અલીએ મુરતઝાના ફરઝંદ

**Peace be upon you, O' son of Ali(a.s) whom  
Alláh was pleased to choose !**



السَّلَامُ عَلَيْكَ يَا بِنَّ فَاطِمَةَ الزَّهْرَاءِ

સલામ થાય આપ પર અય ફાતેમા ઝહેરા (સ.અ.)ના નૂરે  
નઝર,

**Peace be upon you, O' son of Fatima(a.s),  
the most exalted among the women of the  
worlds,**



السَّلَامُ عَلَیْكَ يَا بِنَّ خَدِیجَةَ الْكُبْرَى

સલામ થાય આપ પર અય ખદીજતલ કુબ્રા (સ.અ.)ના  
ફરઝંદ,

**Peace be upon you O' son of Khadeejah  
(a.s), the great, the mother of faithful !**



السَّلَامُ عَلَيْكَ يَا ثَارَ اللَّهِ وَابْنَ ثَارِهِ  
وَالْوَيْثَرَ الْمَوْتُورَ

સલામ થાય આપ પર અય તે કે જેના અને જેમના પિતાના  
ખૂનનો બદલો લેનાર ખુદા છે, અને જેમને એકલા શહીદ કરવામાં  
આવ્યા.

**Peace be upon you whose blood, and the  
blood of whose father was shed in the  
cause of Alláh and can only be avenged by  
Alláh !**



# أَشْهَدُ أَنَّكَ قَدْ أَقَمْتَ الصَّلَاةَ وَآتَيْتَ الزُّكَاةَ

هُنું ગવાહી આપું છું કે તમો નમાઝને કાયમ કરી, ઝકાતને  
અદા કર્યું,

**I bear the witness that you established  
prayers (Namaz) and gave Zakats the fullest  
extent**



وَأَمَرْتُ بِالْمَعْرُوفِ وَنَهَيْتُ عَنِ  
الْمُنْكَرِ

નેકીનો હુકમ આપ્યો અને બુરાઈથી રોક્યા,

**and you enjoined good, and forbade evil,**



# وَأَطَعْتَ اللَّهَ وَرَسُولَهُ حَتَّىٰ أَتَاكَ الْيَقِينُ

તેમજ અલ્લાહના રસુલની ઈતાઅત કરી, અહિયાં સુધી કે મૌત  
આપ સુધી આવી પહોંચ્યું,

**and you obeyed Alláh and His Prophet  
(s.a.w) till death came to you.**



فَلَعَنَ اللَّهُ أُمَّةً قَتَلَتْكَ

અલ્લાહ લાનત કરે તે ઉમ્મત ઉપર કે જે આપને કતલ કર્યા,

**So, curse of Alláh be upon the group who  
killed you**



وَلَعَنَ اللَّهُ أُمَّةً ظَلَمْتَكَ

અલ્લાહ લાનત કરે તે લોકો ઉપર કે જે આપ ઉપર ઝુલ્મ કર્યા,

**and curse of Alláh be upon those who  
oppressed you**



وَلَعَنَ اللَّهُ أُمَّةً سَمِعَتْ بِذَلِكَ فَرَضِيَتْ  
بِهِ

અલ્લાહ લાનત કરે તે લોકો ઉપર કે જેણે તે (ઝુલ્મ) સાંભળ્યો અને તેનાથી ખુશ થયા,

**and curse of Alláh be upon those who  
heard of your oppression and approved the  
same**



یا مَوْلایِ یا اَبَا عَبْدِ اللَّهِ

અય મારા મૌલા ! અય અબા અબ્દીલ્લાહ !

**O' My Master, O' Aba-Abdullah!**



أَشْهَدُ أَنَّكَ كُنْتَ نُورًا فِي الْأَصْلَابِ  
الشَّامِخَةِ

હુ ગવાહી આપું છું કે આપ ઉચ્ચ પુરતોમાં, અને પાક માઓની  
કોખમાં નુર હતાં,

**I bear witness that you were the Divine  
light that descended from sublime loins  
into purified wombs;**



# وَالْأَرْحَامِ الْمُطَهَّرَةِ

જાહેલીયતે પોતાની નજાસતોથી આપને નજીસ નથી કર્યા,

**the ignorance of paganism (wrong belief)  
did not pollute you with its impurities**



لَمْ تُنَجِّسْكَ أَجَاهِلِيَّةٌ بِأَنْجَاسِهَا وَلَمْ  
تُلْبِسْكَ مِنْ مُذَلِّهَمَاتٍ ثِيَابِهَا

અને જાહેલીયતની ખરાબ આદતોની અસરથી આપ દૂર રહ્યા

and its dark clothes could not shroud  
(darken) the splendor of your genesis  
(Generation).



وَأَشْهَدُ أَنَّكَ مِنْ دَعَائِمِ الدِّينِ  
وَأَرْكَانِ الْمُؤْمِنِينَ

ﷺ ગવાહી આપું છું કે આપ દિનના પાયા છો, અને  
મોમીનોના મૂળ છો,

**I bear witness that you are one of the  
Pillars of The Faith and its support, upon  
which the faithful depend.**



وَأَشْهَدُ أَنَّكَ الْإِمَامُ الْبَرُّ النَّقِيُّ  
الرَّضِيُّ الرَّكِيُّ الْهَادِي الْمَهْدِي

હું ગવાહી આપું છું કે આપ ઈમામ, નેક મુત્તકી, અલ્લાહની  
ખુશી પામેલા પાકો પકીઝા, હિદાયત કરનાર માર્ગદર્શક છો,

**I bear witness that you are the excellent,  
the Pious, the devoted and the righteous  
Supreme Head (Imam) guided by Alláh and  
chosen to guide**



وَأَشْهَدُ أَنَّ الْأَئِمَّةَ مِنْ وُلْدِكَ كَلِمَةٌ  
النُّقُوى وَأَعْلَامُ الْهُدَى

હું ગવાહી આપું છું કે આપની ઔલાદમાંથી ઈમામો તકવાની  
અસ્લ (કલેમા) છે, અને હિદાયતના સુતુન છે,

and I bear witness that other Supreme  
Heads (Imams) descending from your  
progeny, are the embodiment of piety and  
the banner of guidance



# وَالْعُرْوَةُ الْوُثْقَىٰ وَالْحُجَّةُ عَلَىٰ أَهْلِ الدُّنْيَا

अने मजबूत रस्सी છે, અને દુનીયાના લોકો ઉપર હુજાત છે,

**and strong (direct) link of the Creator with the creatures and are holding authoritative status from Alláh over mankind.**



وَأَشْهَدُ اللَّهَ وَمَلَائِكَتَهُ وَأَنْبِيَاءَهُ  
وَرُسُلَهُ

હું અલ્લાહ અને તેના મલાએકા અને તેના નબીઓ અને તેના  
રસુલોને ગવાહ બનાવું છું,

**I make Alláh, His Angles, His Prophets and  
His Messengers witness to the fact**



أَنْنِي بِكُمْ مُؤْمِنٌ وَيَايَاكُمْ مُوقِنٌ  
بِشَرَائِعِ دِينِي وَخَوَاتِيمِ عَمَلِي

કે હું આપ તમામ પર ઈમાન રાખું છું, અને આપની રજાત(પાછા ફરવા)નું યકીન રાખું છું, મારા દિનની શરીઅત મુજબ, અને મારા અમાલના ખત્મ થવા ઉપર,

**that I have full faith in you and am confident to the fullest extent of the return of your rule throughout the world**



وَقَلْبِي لِقَلْبِكُمْ سَلْمٌ وَأَمْرِي لِأَمْرِكُمْ  
مُتَّبِعٌ

અને મારું દિલ તમારા દિલ ઉપર તસ્લીમ છે, મારું કામ તમારા હુકમ મુજબ છે.

**and my heart is submissive to your authority and my affairs follow your orders.**



صَلَوَاتُ اللَّهِ عَلَيْكُمْ وَعَلَىٰ أَرْوَاحِكُمْ  
وَعَلَىٰ أَجْسَادِكُمْ

અલ્લાહની રહેમત નાઝીલ થાય આપ ઉપર અને આપની રૂહો  
ઉપર આપના શરીરો ઉપર

**Blessing of Alláh be upon you and upon  
your souls and bodies**



وَعَلَىٰ أَجْسَامِكُمْ وَعَلَىٰ شَاهِدِكُمْ

અને આપના જીસ્મો ઉપર, આપમાંથી હાજર ઉપર,

and upon those among you who are  
witnessing



وَعَلَىٰ غَائِبِكُمْ وَعَلَىٰ ظَاهِرِكُمْ وَعَلَىٰ  
بَاطِنِكُمْ

અને ગાયબ ઉપર, આપના જાહેર ઉપર અને બાતીન (છુપાએલા) ઉપર,

**and those who are unseen and upon all your aspects apparent and hidden (to mankind).**



# Ziyarat Ali ibn Husein (á)

ઝિયારતે અલી ઈબ્ને હુસૈન (અ.સ.)

زِيَارَتِ عَلِيِّ بْنِ الْحُسَيْنِ

(عليه السلام)



السَّلَامُ عَلَيْكَ يَا بْنَ رَسُولِ اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના  
ફરમંદ

**Peace be upon you, O' son of the  
Messenger of Alláh!**



السَّلَامُ عَلَیْكَ يَا بِنَ نَبِيِّ اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહના નબી (સ.અ.વ.)ના  
ફરઝંદ

**Peace be upon you, O' son of the Prophet  
of Alláh!**



السَّلَامُ عَلَیْكَ يَا بْنَ أَمِيرِ الْمُؤْمِنِينَ

સલામ થાય આપ પર અય અમીરુલ મોઅમેનીન ના (અ.સ.)  
ના ફરઝંદ

**Peace be upon you, O' son of Commander  
of the faithfuls!**



# السَّلَامُ عَلَیْكَ يَا بْنَ الْحُسَيْنِ الشَّهِيدِ

સલામ થાય આપ પર અય શહીદ ઈમામ હુસૈન (અ.સ.)ના  
ફરઝંદ

**Peace be upon you, O' son of Hussain (a.s)  
the Martyr!**



# السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الشَّهِيدُ

સલામ થાય આપ પર અય શહીદ, અને શહીદોના ફરઝંદ

**Peace be upon you, O' Martyr!**



السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْمَظْلُومُ وَابْنُ  
الْمَظْلُومِ

સલામ થાય આપ પર અય મઝલુમ, અને મઝલુમના ફરઝંદ

**Peace be upon you, O' Oppressed and the  
son of Oppressed!**



لَعْنِ اللَّهِ أُمَّةً قَتَلَتْكَ

અલ્લાહ લાનત કરે તે ઉમ્મત ઉપર કે જે આપને કતલ કર્યા,

**Curse of Allah be upon the group who  
killed you**



وَلَعَنَ اللَّهُ أُمَّةً ظَلَمْتَكَ

અલ્લાહ લાનત કરે તે લોકો ઉપર કે જે આપ ઉપર ઝુલ્મ કર્યો,

**and the curse of Allah be upon the group  
who oppressed you**



وَلَعَنَ اللَّهُ أُمَّةً سَمِعَتْ بِذَلِكَ  
فَرَضِيَتْ بِهِ

અલ્લાહ લાનત કરે તે લોકો ઉપર કે જેણે તે (ઝુલ્મ) સાંભળ્યો અને તેનાથી ખુશ થયા,

**and curse of Allah be upon those who heard of your oppression and approved the same.**



**Devotional Salutation  
to all the Martyrs of  
Karbala**

जियारते तमाम शोहदाओ करबला

زِيَارَةُ شُهَدَاءِ كَرْبَلَاءِ



السَّلَامُ عَلَيْكُمْ يَا أَوْلِيَاءَ اللَّهِ وَ  
أَحِبَّاءَهُ

સલામ થાય આપ પર અય અલ્લાહના વલીઓ અને  
અલ્લાહના દોસ્તો,

**Peace be upon you all, O' devotees of Alláh  
and his lovers!**



السَّلَامُ عَلَيْكُمْ يَا أَصْفِيَاءَ اللَّهِ وَ  
أَوْلِيَاءَهُ

સલામ થાય આપ પર અય અલ્લાહના તરફથી ચૂંટાએલા  
અને અલ્લાહના પ્યારાઓ

**Peace be upon you all, O' selected ones of  
Alláh and his dear ones!**



السَّلَامُ عَلَيْكُمْ يَا أَنْصَارَ دِينِ اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહના દિનના મદદગારો,

**Peace be upon you all, O' supporters of the  
religion of Alláh!**



السَّلَامُ عَلَيْكُمْ يَا أَنْصَارَ رَسُولِ اللَّهِ

સલામ થાય આપ પર અય અલ્લાહના રસુલ (સ.અ.વ.) ના  
મદદગારો,

**Peace be upon you all, O' supporters of the  
Prophet of Alláh!**



السَّلَامُ عَلَيْكُمْ يَا أَنْصَارَ أَمِيرِ  
الْمُؤْمِنِينَ

સલામ થાય આપ પર અય અમીરુલ મોઅમેનીન (અ.સ.) ના  
મદદગારો,

**Peace be upon you all, O' supporters of the  
Commander of the faithfuls (Hazrat Ali A.S)!**



السَّلَامُ عَلَيْكُمْ يَا أَنْصَارَ  
فَاطِمَةَ سَيِّدَةِ نِسَاءِ الْعَالَمِينَ

સલામ થાય આપ પર અય દુનિયાની સ્ત્રીઓના સરદાર ફાતેમા  
(સ.અ.)ના મદદગારો,

**Peace be upon you all, O' supporters of  
Fatemah the most exalted amongst the  
woman of the worlds!**



السَّلَامُ عَلَيْكُمْ يَا أَنْصَارَ أَبِي  
مُحَمَّدٍ الْحَسَنِ بْنِ عَلِيٍّ الْوَلِيِّ النَّاصِحِ

સલામ થાય આપ પર અય અબુ મોહંમદ, હસન ઈબને અલી  
(અ.સ.), વલી અને નસીહત કરનારના મદદગારો

**Peace be upon you all, O' supporters of  
Abi-Mohammad Al-Hassan (a.s) son of Ali  
(a.s) the pure, the guide and the trusted  
one!**



السَّلَامُ عَلَيْكُمْ يَا أَنْصَارَ أَبِي عَبْدِ  
اللَّهِ

સલામ થાય આપ પર અય અબુ અબ્દીલ્લાહ (અ.સ.) ના  
મદદગારો

**Peace be upon you all, O' supporters of  
Aba Abdullah Al Hussain!**



# بِأَبِي أَنْتُمْ وَأُمِّي

મારા માંબાપ આપ પર કુરબાન થાય,

**May my father lay his life for you all and  
may my mother too sacrifice her life for you  
all!**



طِبْنُكُمْ وَ طَابَتِ الْأَرْضُ الَّتِي فِيهَا  
دُفِنْتُمْ

આપ પાક છો અને તે ઝમીન પણ પાક થઈ ગઈ જ્યાં આપને દફન  
કરવામાં આવ્યા,

**You have become blessed and blessed is  
the land in which you are buried;**



وَ فُزْتُمْ فَوْزًا عَظِيمًا

અને આપ કામિયાબ થઈ ગયા,

**You all have attained greatest success**



فَيَا أَيَّتَنِي كُنْتُ مَعَكُمْ فَأَفُوزَ مَعَكُمْ

અને અય કાશ ! હું પણ આપની સાથે હોત તો કામિયાબી સુધી પહોંચી શકતે

and how I wish I was along with you all to achieve the same glory that you all attained.



# Ziyarat Abbas ibn Ali (a)

ઝિયારતે હ. અબ્બાસ ઈબને અલી (અ.સ.)

زِيَارَةُ الْعَبَّاسِ بْنِ عَلِيٍّ  
(عليه السلام)



السَّلَامُ عَلَيْكَ يَا أَبَا الْفَضْلِ الْعَبَّاسِ  
بْنِ أَمِيرِ الْمُؤْمِنِينَ

સલામ થાય આપ પર અય અબુલફઝલીલ અબ્બાસ,  
અમીરુલ મોઅમેનીન (અ.સ.) ના ફરઝંદ

**Peace be on you, O' Abul Fadhl, al Abbas,  
son of Ameerul Mumineen**



السَّلَامُ غَا لِيكَ يَا بِن سَيِّدِ الْوَصِيَّيْنِ

સલામ થાય આપ પર અય સરદારે અવસિયાના ફરઝંદ

**Peace be on you, O' son of the chief of the successors.**



السَّلَامُ عَلَيْكَ يَا بْنَ أَوَّلِ الْقَوْمِ  
إِسْلَامًا

સલામ થાય આપ પર અય તે બુઝુર્ગના ફરઝંદ કે જેણે  
સૌપ્રથમ ઈસ્લામ જાહીર કર્યો,

**Peace be on you, O' son of the (one who  
was) the first to accept Islam, in the  
community.**



وَأَقْدَمِهِمْ إِيْمَانًا

જેઓ ઈમાનમાં સૌથી પ્રથમ

**The foremost in faith**



# وَ أَقْوَمِهِمْ بِدِينِ اللَّهِ

અને અલ્લાહના દિન પર કાએમ રહેવા વાળા

**The most firm on the religion of Allah,**



# وَأَخْوَاتِهِمْ عَلَى الْإِسْلَامِ

અને ઈસ્લામની સૌથી વધુ હિફાઝત કરવાવાળા

**And the most dedicated to guard over Islam**



أَشْهَدُ لَقَدْ نَصَحْتَ لِلَّهِ وَ لِرَسُولِهِ

હું ગવાહી આપું છું કે તમે અલ્લાહ, તેના રસૂલ (સ.અ.વ.)  
અને તમારા ભાઈ માટે સાચી સલાહ આપી,

**I bear witness that you advised in the way  
of Allah, and his messenger,**



وَلِأَخِيكَ فَنِعْمَ الْأَخُ الْمُوَاسِي

અને તમે બહેતર ભાઈ છો અને ભાઈની હમદદી કરવાવાળા!

**and your brother, How great a consoler you  
were as a brother!**



فَلَعَنَ اللَّهُ أُمَّةً قَتَلَتْكَ

અલ્લાહ લાનત કરે તે લોકો પર જેણે આપને કતલ કર્યા,

**May Allah curse the people who killed you,**



وَ لَعَنَ اللَّهُ أُمَّةً ظَلَمَتْكَ

અલ્લાહ લાનત કરે તે લોકો પર જેણે આપ પર ઝુલ્મ કર્યો

**May Allah curse the people who oppressed  
you,**



وَلَعَنَ اللَّهُ أُمَّةً  
أَسْتَحَلَّتْ مِنْكَ  
الْمَحَارِمَ

અલ્લાહ લાનત કરે તે ટોળા પર જેઓએ આપની બેહુરમતીને  
જાએઝ સમજી

and may Allah curse the people who regard  
lawful from you what was forbidden (?)



وَأَنْتَهَكْتَ حُرْمَةَ الْإِسْلَامِ

અને ઈસ્લામની હુરમત બરબાદ કરી.

**and violated the sanctity of Islam.**



# فَنِعَمَ الْأَخُ الصَّابِرُ الْمُجَاهِدُ الْمُحَامِي النَّاصِرُ

આપ બેહતર સબ્ર કરવાવાળા છો જેહાદ કરવાવાળા છો,  
હામી અને મદદગાર છો,

**How wonderful is the patient one, the  
fighter, the protector, the helper,**



وَالْأَخُ الدَّافِعُ عَنْ أُخِيهِ الْمُجِيبُ إِلَيَّ  
طَاعَةَ رَبِّهِ

આપના ભાઈની મુસીબતો દૂર કરનાર ભાઈ છો, પરવરદિગારની  
ઈતાઅતને કબૂલ કરનાર છો

and the brother who defends his brother,  
who responds to the obedience of His Lord,



الرَّاعِبُ فِيمَا زَهَدَ فِيهِ غَيْرُهُ مِنْ  
الثَّوَابِ الْجَزِيلِ

તે બાબતની રગબત કરનાર છો જેને બીજાઓએ છોડી દીધી કે જે  
ખૂબજ સવાબ,

**who hopes for that which others have  
renounced of abundant reward.**



# وَالْتَّائِ الْجَمِيلِ

અને સારી સારી ખૂબીઓ છે,

**and beautiful praise**



وَأَلْحَقَكَ اللَّهُ بِدَرَجَةِ آبَائِكَ فِي جَنَّاتِ  
النَّعِيمِ

અને આપને આપના બુઝુર્ગોની સાથે જન્નતે નઈમમાં રાખે.

**May Allah join you with the ranks of your  
fathers in the heaven.**



اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

અય અલ્લાહ ! મોહંમદ (સ.અ.વ.) અને આલે મોહમદ (સ.અ.વ.)  
ઉપર સલવાત નાઝિલ કર.

**O Alláh send Your blessings on Muhammad  
and the family of Muhammad.**



એક સુરે ફાતેહા કુલ  
મહુમીન માટે પઢવાની  
દરખાસ્ત